Ambuja Cement

ACL:SEC 25 March 2022

Bombay Stock Exchange Limited Phiroz Jeejeebhoy Towers, Dalal Street, Mumbai-400 023 Scrip Code:500425

National Stock Exchange of India Itd., Plot No.C/1 'G' Block Sandra - Kurla Complex Sandra East, Mumbai 400 051 Scrip Code:AMBUJACEM

Dear Sir/ Madam,

Sub: Newspaper Publication regarding the 39th Annual General Meeting of Ambuja Cements Limited through Audio/ Visual mode and E-voting process.

Pursuant to the applicable provisions of the Companies Act, 2013 and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time and General Circular Nos. 14/2020,17/2020, 20/2020, 02/2021 and 21/2021 dated April 8,2020, April 30,2020, May 5, 2020, January 13, 2021 and December 14, 2021 issued by the Ministry of Corporate Affairs, the Company has made a public notice informing about the 39th Annual General Meeting of the Company scheduled on Friday, April 29, 2022 through Audio/ Visual mode and Electronic voting process. We hereby submit the copies of the public notice published in English newspaper- Financial Express and Regional (Gujarati) newspaper- Financial Express on March 25, 2022, for your information and the same is also uploaded on the website of the Company at www.ambujacement.com

We request you to take the above information on record.

Thanking you,

Yours faithfully,

For AMBUJA CEMENTS LIMITED

RAJIV GANDHI COMPANY SECRETARY Membership No A 11263

Encl:- as above

FINANCIAL EXPRESS

Procurement via GeM crosses record ₹1 trn

BANIKINKAR PATTANAYAK New Delhi, March 24

A SPURT IN purchases by various ministries and departments drove up the procurement of goods and services through the government emarketplace (GeM) portal to a record ₹1 trillion this fiscal. GeM chief executive PK

Singh said before the latest feat, procurement through the portal had breached the ₹1-trillionmark only in about four-and-ahalf years. Now, it has been achieved in the current fiscal itself. It has emerged as one of the top five e-public procurement systems globally, he added. He exuded confidence procurement via GeM will exceed ₹1.5 trillion in the next fiscal.

The GeM portal was launched in August 2016, as the Centre wanted to improve transparency in purchases of various goods and services by all the central government ministries, departments and public-sector firms and state governments, apart from providing a new-age platform for

■ GeM had earlier logged ₹1-trillion-mark in about four-and-a-half years ■ Portal is now **one of the** top five e-public procure-

ment systems globally ■ CEO PK Singh confident procurement via GeM will exceed ₹1.5 trillion in the next fiscal



official procurement. Sellers range from small business to large companies. Interestingly, there are no Chinese products sold on the portal, Singh added. Procurement by central public sector enterprises alone jumped many folds to about ₹43,000 crore in FY22.

Prime Minister Narendra Modi, too, hailed the performance of the GeM portal and added that the platform is especially empowering the small businesses. "Happy to know that @GeM_India has achieved order value of Rs 1 Lakh Crore in a single year! This is a significant increase from previous years," he tweeted. The portal will allow online

buying and selling by panchayats in a big way. "The pilot in Gurugram district panchayats has been successfully completed and we will now roll out this across the country," Singh said. It's also in an advanced stage of integration with India Post for extending logistic services across the country. Moreover, at least 10,000 start-ups have so far registered on the GeM platform. Uttar Pradesh, Delhi, Gujarat and Madhya Pradesh lead the pack of state governments in purchasing through this portal.


At \$190 bn, FY22 trade deficit around previous record, but less onerous now

BANIKINKAR PATTANAYAK New Delhi, March 24

INDIA'S MERCHANDISETRADE deficit is set to breach the earlier record of \$190 billion by a whisker in the current fiscal. But a close look at the data suggests the deficit, as a percentage of overall merchandise commerce, is still way below the earlier peak. Trade deficit already hit

\$188.2 billion as of March 21 this fiscal. At this rate, it's expected to touch 19% of overall goods trade in FY22, compared with a record 24% in FY13, 23% in FY12 and 20.5% in the pre-pandemic year of FY20 (See chart).

In the last fiscal, however, given a Covid-induced demand compression in the economy, imports shrank at a much faster pace than exports, leading to a drop in deficit to just 15% of overall merchandise trade. However, deficit in H2 of this fiscal grew dramatically, especially in the third quarter, as domestic demand had rebounded before the Omicron onslaught in January. This keeps up pressure on the current account deficit (CAD) at a time



foreign portfolio when investors have turned net sellers in recent months.

Pronab Sen, noted economist and former chairman of the National Statistical Commission, said while the export sector has performed well in FY22 the more important question is whether this growth in outbound shipments (37% year-on-year)will sustain. Moreover, imports went up sharply this fiscal, partly because an income distribution in favour of the richer segment of population in the wake of the Covid outbreak led to higher purchases of (imported) luxury

goods, Sen added. Analysts also said if exports

lose pace in the next fiscal and imports continue to rise, the pressure on the current account will only rise.

Aditi Nayar, chief economist at Icra, expected the CAD to have crossed 3% in the October-December 2021 period for the first time since the June quarter of 2013. However, it may recede somewhat in the ongoing quarter. In absolute terms, she estimated the CAD at \$25-28 billion in the third quarter, and a moderately lower \$20-23 billion in Q4 FY2022.

Bank of Baroda chief econo-

mist Madan Sabnavis estimated the CAD to be around 3% in the third quarter, which may ease to 2.5% in the March quarter.

Merchandise exports exceeded an ambitious target of \$400 billion for FY22 nine days before the fiscal is set to end, staging a smart rebound after a 7% drop last fiscal due to the pandemic. Exports jumped 37%, albeit on a contracted base, to \$400.8 billion as of March 21, driven by a stellar performance by sectors like engineering, electronics, gems and jewellery, chemicals and petroleum products. Imports during this period, too, rose sharply to \$589 billion, driven by a spike in oil prices and massive purchases of coal and gold.

However, the Ukraine crisis has now posed fresh risks for exporters, as global supply chains remain tangled and shipping costs have skyrocketed across countries. Of course, it has also created some opportunities for Indian suppliers of wheat (Russia and Ukraine are large exporters of the grain) and some other farm commodities in the export market.

House nod to final supplementary demands for grants for FY22

FE BUREAU New Delhi, March 24

THE GOVERNMENT HAS received approval for an additional spending of ₹1.58 trillion, as Parliament has cleared the third batch of supplementary demands for grants for the current fiscal.

This involves a higherthan-expected net cash outgo of ₹1.07 trillion; the rest (₹50,946 crore) would be met through savings or enhanced receipts of various ministries and departments.

Some of the key proposals involving the extra net cash outgo were for credit-linked subsidy scheme under the Pradhan Mantri Awas Yojana-Urban (₹30,170 crore); for the payment of urea subsidy (₹14,902 crore); for the new development financial institution, called NaBFID, and recapitalisation of state-run insurers (₹13,049 crore) and for contributions to and grants for the Employees' Pension Scheme (₹9,211 crore).

(This is only an advertisement for information purposes and not a prospectus announcement)

Our Company was originally incorporated as "Swaraj Suiting Private Limited" on June 9, 2003 vide certificate of incorporation bearing Corporate Identity No. U18101RJ2003PTC018359 under the provisions of Companies Act, 1956 issued by the Registrar of Companies Rajasthan, Jaipur. Subsequently, the company was converted into Public Limited Company vide a fresh certificate of incorporation issued by ROC-Jaipur, consequent upon conversion from Private Limited to Public Company dated September 22, 2020 in the name of "Swaraj Suiting Limited". The Corporate Identification Number of our Company changed to U18101RJ2003PLC018359. For further details, please refer to section titled "Our History and Certain Corporate Matters" beginning on page no 98 of the Prospectus.

Registered & Corporate office: F-483 To F-487, RIICO Growth Centre Hamirgarh-311025, Bhilwara, Rajasthan, India Contact Person: Mr. Rahul Kumar Verma, Company Secretary & Compliance Officer; Tel No: 9660630663 **E-Mail ID:** cs@swarajsuiting.com; **Website:** www.swarajsuiting.com;

OUR PROMOTERS: (I) MOHAMMED SABIR KHAN, (II) Mrs. SAMAR KHAN AND (III) Mr. NASIR KHAN

dated March 09, 2022 from NSE for using its name in this offer document for listing of our shares on the SME Platform of National Stock Exchange of India Limited ("NSE EMERGE"). For the purpose of this Issue, the Designated Stock Exchange will be the National Stock Exchange of India Limited ("NSE"). The trading is proposed to be commenced on or about March 28, 2022*. * Subject to receipt of listing and trading approvals from the National Stock Exchange of India Limited. SUBSCRIPTION DETAILS

The Issue was subscribed to an extent of 11.53 times i.e., Gross Subscription of Rs.123.16 crores for 21,994,000 equity shares were based on the bid file received from NSE on the day after closure of the Issue received as against Rs. 10.68 crores for 1,908,000 equity shares. (Including subscription by Market Makers to the Issue was subscribed to an extent of 9.83 times (after technical rejection and bids not banked). i.e Net Subscription of Rs. 105.01 crores for 18,752,000 equity shares after eliminating technically rejected and bid not banked applications. 1,216 applications for 2,996,000 shares were bidded without banking.

Sr.	Category	Gross Application		Less: Rejo	ections	Valid		Allotment			
No		No. of Application	Equity Share								
1 1	Retail Individual Applicants	3,556	7,112,000	101	202,000	3,455	6,910,000	454	908,000		
2	Non-Retail Applicants	355	11,820,000	0 11	74,000	344	11,746,000	206	904,000		
3	Market Maker	1	96,000		- 8	1	96,000	1 1	96,000		
- 8	Total	3,912	19,028,000	112	276,000	3,800	18,752,000	661	1,908,000		
Allocation: The Basis of Allotment was finalized in consultation with the Designated Stock Exchange – National Stock Exchange of India Limited on March 23, 2022											

A. Allocation to Market Maker (After Technical & Multiple Rejections and Withdrawal): The Basis of Allotment to the Market Maker, at the issue price of ₹ 56/- per Equity Share, was finalised in consultation with NSE. The category was subscribed by 1.00 time. The total number of shares allotted in this category is 96,000 Equity shares

Sr.No No. of Shares applied for (Category wise	Number of applications received)	% to total	Total No. of Shares applied in each category	% to total	Ratio of allott applicant		Number of successful applicants(after rounding)	Total No. of shares allocated/alloted
1 96000	1	100	96000	100	1	1	1	96000
Grand Total B. Allocation to Retail Ind	1	100	96000	100	tail Individual Inv		1 the issue price of ₹ 56/- per	96000

% to total Total No. of Shares applied in each Ratio of allottees to Total No. of shares No. of Shares applied for | Number of applications received applicants(after rounding) allocated/alloted (Category wise)

consultation with NSE. The category was subscribed by 7.61 times i.e. for 6,910,000 Equity Shares. Total number of shares allotted in this category is 908,000 Equity Shares to 3455 successful applicants

consultation with NSE. The category was subscribed by 12.99 times i.e. for 11,746,000 shares. Total number of shares allotted in this category is 904,000 Equity Shares to 344 successful applicants

Sr.No No. of Number of % to Total No. of % to Ratio of Number of Total No. Sr. No No. of Number of % to Total No. of % to total Ratio of allottees to

100 908000 C. Allocation to Other than Retail Individual Investors (After Technical Rejections & Withdrawal): The Basis of Allotment to Other than Retai

51.110	Shares applied for (Category wise)	applications received	total	Shares applied in each category	total	allot	ttees to licants	successful applicants(after rounding)	of shares allocated/ alloted	51.110	Shares applied for (Category wise)	applications received	total	Shares applied in each category	76 to total		licants	successful applicants(after rounding)	of shares allocated/ alloted
1	4000	59	17.15	236000	2	9	59	9	18000	36	64000	2	0.58	128000	1.08	1	1	2	8000
2	6000	35	10.17	210000	1.78	8	35	8	16000	37	0	0	0	0	0	1	2	1	2000
3	8000	24	6.97	192000	1.63	7	24	7	14000	38	68000	2	0.58	136000	1.15	1	1	2	8000
4	10000	18	5.23	180000	1.53	7	18	7	14000	39	0	0	0	0	0	1	2		2000
5	12000	19	5.52	228000	1.94	9	19	9	18000	40	76000	1	0.29	76000	0.64	1	1	1	6000
6	14000	13	3.77	182000	1.54	7	13	7	14000	41	78000	1	0.29	78000	0.66	1	1	1	6000
7	16000	16	4.65	256000	2.17	5	8	10	20000	42	80000	4	1.16	320000	2.72	1	1	4	24000
8	18000	17	4.94	306000	2.6	12	17	12	24000	43	84000	1	0.29	84000	0.71	1	1	1	6000
9	20000	18	5.23	360000	3.06	7	9	14	28000	44	86000	1	0.29	86000	0.73	1	1	1	6000
10	22000	9	2.61	198000	1.68	8	9	8	16000	45	88000	2	0.58	176000	1.49	1	1	2	12000
11	24000	8	2.32	192000	1.63	7	8	7	14000	46	0	0	0	0	0	1	2		2000
12	26000	4	1.16	104000	0.88	1	1	4	8000	47	90000	4	1.16	360000	3.06	1	1	4	24000
13	28000	9	2.61	252000	2.14	1	1	9	18000	48	0	0	0	0	0	1	2		4000
14	0	0	0	0	0	1	9		2000	49	96000	1	0.29	96000	0.81	1	1	1	8000
15	30000	8	2.32	240000	2.04	1	1	8	16000	50	100000	4	1.16	400000	3.4	1	1	4	24000
16	0	0	0	0	0	1	8		2000	51	0	0	0	0	0	3	4		6000
17	32000	2	0.58	64000	0.54	1	1	2	4000	52	112000	1	0.29	112000	0.95	1	1	1	8000
18	34000	7	2.03	238000	2.02	1	1	7	14000	53	118000	1	0.29	118000	1	1	1	1	10000
19	0	0	0	0	0	2	7		4000	54	120000	1	0.29	120000	1.02	1	1	1	10000
20	36000	8	2.32	288000	2.45	1	1	8	16000	55	128000	1	0.29	128000	1.08	1	1	1	10000
21	0	0	0	0	0	3	8	1	6000	56	132000	1	0.29	132000	1.12	1	1	1	10000
22	38000	3	0.87	114000	0.97	1	1	3	6000	57	134000	1	0.29	134000	1.14	1	1	1	10000
23	0	0	0	0	0	1 8	3		2000	58	140000	1	0.29	140000	1.19	1	1	1	10000
24	40000	8	2.33	320000	2.72	1	1	8	16000	59	146000	1	0.29	146000	1.24	1	1	1	12000
25	0	0	0	0	0	1	2		8000	60	154000	1	0.29	154000	1.31	1	1	1	12000
26	42000	1	0.29	42000	0.35	1	1	1	4000	61	178000	3	0.87	534000	4.54	1	1	3	42000
27	44000	2	0.58	88000	0.74	1	1	2	4000	62	180000	1	0.29	180000	1.53	1	1	1	14000
28	0	0	0	0	0	1	2		2000	63	200000	2	0.58	400000	3.4	1	1	2	28000
29	46000	2	0.58	92000	0.78	1	1	2	8000	64	0	0	0	0	0	1	2		2000
30	50000	4	1.16	200000	1.7	1	1	4	16000	65	330000	1	0.29	330000	2.8	1	1	1	26000
31	52000	2	0.58	104000	0.88	1	1	2	8000	66	356000	1	0.29	356000	3.03	1	1	1	28000
32	56000	1	0.29	56000	0.47	1	1	1	4000	67	358000	1	0.29	358000	3.04	1	1	1	28000
33	60000	3	0.87	180000	1.53	1	1	3	12000	68	730000	1	0.29	730000	6.21	1	1	1	56000
34	0	0	0	0	0	1	3		2000	69	750000	1	0.29	750000	6.38	1	1 8	1	58000

The Board of Directors of the company at its meeting held on March 23, 2022 has approved the Basis of Allotment of Equity shares as approved by the Designated stock Exchange viz. National Stock Exchange of India Limited and at a meeting held on March 23, 2022 has authorized the corporate action for the transfer and allotment of the Equity Shares to various successful applicants. In terms of the Prospectus dated March 09, 2022 and as per the SEBI (ICDR) Regulations, 2018 wherein a minimum of 50% of the net offer of shares to the Public shall initially be made available for allotment to retail individual investors as the case may be. The balance net offer of shares to the public shall be made available for allotment to a) individual applicants other than retail investors, including Corporate Bodies / Institutions irrespective of number of shares applied for. The unsubscribed portion of the net offer to any one of the categories specified in (a) or (b) shall be made available for allocation in the other category, if so required. "For the purpose of

Grand Total

sub-regulation (2) of regulations 253, if the retail individual investor category is entitled to more than fifty per cent on proportionate basis, the retail individual investors shall be allocated that higher percentage" The instructions to Self Certified Syndicate Banks for unblocking the amount was processed on or before March 24, 2022. Further, the CAN-cum-Refund advices and allotment advice and/or notices will be forwarded to the address/ email id of the Applicants as registered with the depositories as filled in the application form on or before March 25, 2022. In case the same is not received within 10 days, investors may contact at the address given below. The Equity Shares allocated to successful applicants are being credited to their beneficiary accounts subject to validation of the account details with the depositories concerned. The Company is taking steps to get the Equity Shares admitted for trading on the NSE EMERGE within six working days from the date of the closure of the Issue.

Note: All capitalized terms used and not defined herein shall have the respective meanings assigned to them in the Prospectus dated March 09, 2022 ("Prospectus") INVESTORS PLEASE NOTE The details of the allotment made would also be hosted on the website of the Registrar to the Issuer, BIGSHARE SERVICES PRIVATE LIMITED at https://ipo2.bigshareonline.com/ IPO_Status.html. All future correspondence in this regard may kindly be addressed to the Registrar to the Issue quoting full name of the First/ Sole applicants, serial number of the Application Form, number of shares

Place: Bhilwara

Date: 24.03.2022

The category wise details of the Basis of Allotment are as under:

BIGSHARE SERVICES PRIVATE LIMITED

applied for and Bank Branch where the application had been lodged and payment details at the address of the Registrar given below:

1st Floor, Bharat Tin Works Building, Opp. Vasant Oasis, Makwana Road, Marol, Andheri East, Mumbai-400059 Tel: 022-62638200, Fax No: 022-62638280; Email: ipo@bigshareonline.com Contact Person: Mr. Swapnil kate

Website: www.bigshareonline.com Investor Grievance Email: investor@bigshareonline.com SEBI Registration No.: INR000001385

On behalf of the Board of Directors

For SWARAJ SUITING LIMITED

THE LEVEL OF SUBSCRIPTION SHOULD NOT BE TAKEN TO BE INDICATIVE OF EITHER THE MARKET PRICE OF THE EQUITY SHARES ON LISTING OR THE BUSINESS PROSPECTS OF SWARAJ SUITING LIMITED

Managing Director

Ambuja Cement

AMBUJA CEMENTS LIMITED

Regd. Office: P.O Ambujanagar, Tal. Kodinar, Dist. Gir-Somnath, Gujarat 362715. Corporate Office: Elegant Business Park, MIDC Cross Road "B", Off Andheri-Kurla Road, Andheri (East), Mumbai-400059.

CIN No: L26942GJ1981PLC004717 . Website: www.ambujacement.com email: investors.relation@ambujacement.com

NOTICE FOR 39TH ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 39th Annual General Meeting of the Company ("AGM") will be held on Friday April 29, 2022 at 2.00 P.M. IST through Video Conference ("VC")/ Other Audio Visual Means ("OAVM") facility as per the provisions of the Companies Act, 2013 and Rules framed thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with General Circular Nos.14/2020, 17/2020, 20/2020, 02/2021 and 21/2021 dated April 8, 2020, April 13, 2020, May 5, 2020, January 13 2021 and December 14/2021 respectively, issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and provisions of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) ("Listing Regulations"), without the physical presence of the Members at a common venue.

The Annual Report of the Company for the year 2021 including the Financial Statements for the year ended December 31, 2021 ("Annual Report") along with Notice of AGM will be sent by email to those Members. whose e-mail addresses are available with the Company's Registrar and Share Transfer Agent, LinkIntime India Pvt Ltd and whose email addresses are registered with the Company or with their respective Depository Participants ("Depository"). The Annual Report along with the AGM notice will be sent in physical mode to all those Members whose e-mail addresses are not registered with the Company/LinkIntime/DP. Members can join and participate in the AGM through VC/ OAVM facility only. The instructions for joining the

AGM and the manner of participation in the remote electronic voting or casting vote through the e-voting

system during the AGM are provided in the Notice of the AGM. Members participating through the VC/OAVM

facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013. The Notice of the AGM and the Annual Report will also be available on the website of the Company i.e. www.ambujacement.com and the website of Bombay Stock Exchange Limited and National Stock Exchange of India Limited www.bseindia.com and www.nseindia.com. Members holding shares in demat mode can update their email address with their depository and those

holding in physical form, who have not registered their email addresses with the Company/Registrar can obtain Notice of the AGM, Annual Report and/or login details for joining the AGM through VC/OAVM facility including e-voting, by sending scanned copy of the following documents by email to investors.relation@ambujacement.com

- a) a signed request letter mentioning your name, folio number and complete address;
- b) self-attested scanned copy of the PAN Card; and
- self-attested scanned copy of any document (such as AADHAAR Card, Driving License, Election Identity Card, Passport) in support of the address of the Member as registered with the Company.

Members holding shares in physical form are advised to update their PAN, KYC (e-mail address, mobile number, bank account, signature etc.) and Nomination details as mandated under SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD RTAMB/P/CIR/2021/655 dated November 3, 2021 read with clarification circular SEBI/HO/MIRSD/MIRSD RTAMB/P/CIR/2021/687 dated December 14, 2021 to avoid freezing of their folios on or after April 1, 2023.

The Company has extended the facility of electronic credit of dividend directly to the respective bank accounts of the Member(s) through Electronic Clearing Service (ECS)/National Electronic Clearing Service (NECS)/Real Time Gross Settlement (RTGS)/Direct Credit/NEFT. In order to receive the dividend amount without any delay. the Members holding shares in physical form are requested to submit particulars of their bank accounts along with the original cancelled cheque bearing the name of the member and self-attested copy of PAN card to LinkIntime India Pvt Ltd., C 101, 247 Park, LBS Marg, Surva Nagar, Gandhi Nagar, Vikhroli West, Mumbai, Maharashtra 400083 to update their bank account details and all those eligible shareholders holding shares in demat mode are requested to update with their respective depositories their correct bank account number. including 9 digit MICR Code and 11 digit IFSC code, Email Id and Mobile number before Thursday March 31st, 2022.

In terms of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended, and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing the facility to its Members to exercise their right to vote by electronic means on any or all of the businesses specified in the Notice convening the 39th AGM of the Company ('remote E-voting'), through E-voting services of CDSL.

The relevant details of voting are given as under:

- a) Member holding shares either in physical form or in dematerialized form and whose name is recorded in the register of Members or in the register of beneficial owners maintained by the depositories, as on the cut-off date, i.e. Friday, April 22, 2022 ('eligible Members'), shall be entitled to exercise their right to vote by remote E-voting as well as voting to be held at AGM on any or all of the businesses specified in the Notice convening the 39" AGM of the Company;
- The remote E-voting period commences on Monday, April 25, 2022 (10:00 a.m. IST) and ends on Thursday, April 28, 2022 (5:00 p.m. IST);
- c) The remote E-voting module shall be disabled for voting after the expiry of the date and time mentioned above. Once the vote on a resolution(s) is cast by the Member, the Member shall not be allowed to change

d) Those Members, who will be present in the AGM through VC / OAVM facility and have not cast their vote on

- the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM on all of the businesses specified in the Notice convening the 39th AGM. Further, an eligible Member may participate in the AGM even after exercising his right to vote through remote E-voting but shall not vote again during the AGM. Only the eligible Members shall be entitled to avail the facility of remote E-voting or the E-voting during the AGM;
- In case a person has become a Member of the Company after the Notice is being sent but on or before the cut-off date for E-voting, i.e. Friday, April 22, 2022 may write to the CDSL on the email ID: helpdesk.evoting@cdslindia.com or to Mr. Rakesh Dalvi, Manager, (CDSL,) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call 022-23058738, 23058542 for obtaining the credentials for remote E-voting:
- The Board of Directors has appointed Mr. Surendra Kanstiya, of M/s Surendra Kanstiya & Associates, Practicing Company Secretaries as a Scrutinizer to scrutinize the voting process in a fair and transparent manner; and
- Members will be able to attend the AGM through VC / OAVM or view the live webcast of AGM provided by CDSL at https://www.evotingindia.com by using their remote e-voting login credentials.

If any Member wishes to get a printed copy of the Annual Report, the Company will send the same, without any charges, upon receipt of a specific request from the Member.

In case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or call 022-23058738, 23058542.

The Annual Report, Notice, E-voting procedure and other relevant documents, will be available on the Company's website at www.ambujacement.com for inspection.

The above information is being issued for the information and benefit of all the Members of the Company and is incompliance with the MCA Circulars.

> RAJIV GANDHI COMPANY SECRETARY

For AMBUJA CEMENTS LTD

Place: Mumbai Date: 24" March 2022

Membership No A11263

11746000

એનપીએ મેનેજમેન્ટ ગ્રુપ, આઈડીબીઆઈ ટાવર, ડબ્લ્યુટીસી કોમ્પલેક્ષ, કફ પરેડ, મુંબઈ - ૪૦૦ ૦૦૫ ટેલિ. નં. : ૦૨૨-૬૬૫૫૩૪૧૩/૨૨૫૬

કરજદાર સ્ટાર ડિઝીટલ પ્રાન્લિન્ના એકાઉન્ટની સુરક્ષીત મીલકતની ખાનગી કરારનામા હારા વેચાણ નોટીસ

રૂલ ૮(૫) અને (૬) સાથે વાંચતા નિયમ ૯(૧) સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ ૨૦૦૨)

કરજદાર : સ્ટાર ડિઝીટલ પ્રા. લિ. જેની રજીસ્ટર્ડ આફીસ : ૩૦૨, નર્મદા એપાર્ટમેન્ટ, કડીવાલા સ્કુલની પાસે, ર્ટીંગરોડ, સુરત - ૩૯૫૦૦૨.

કરજદાર / ગીરામુકનાર : શ્રી ધર્મેશ બચુભાઈ મોદી (શ્રી બચુભાઈ મોદીના પુત્ર), શ્રીમતી દિમ્પલ ધર્મેશ મોદી (ધર્મેશ બચુભાઈ મોદીની પંતન) અને ધર્મેશ બચુભાઈ મોદી (કર્તા શ્રી ધર્મેશ બચુભાઈ મોદી)

સરફેસી એક્ટ સેક્શન ૧૩(૨) મુજબ ડિમાન્ટ નોટીસની તારીખ ૦૯ ઓગસ્ટ ૨૦૧૬ થી **બાકી રકમ ઃ રા. ૫,૬૪,૨૮,૫૭૨** (પાંચ કરોડ ચોસઠ લાખ અઠાવીસ હજાર પાંચસો બોત્તેર રૂપીચા/-)

सुरक्षीत भिलङतनी विगत :

૧. ફ્લેટ નં. ૩૦૨ (૬૩૦ સ્કે.ફીટ) જે શ્રીમતી દિમ્પલ ધર્મેશ મોદી અને ફ્લેટ નં. ૩૦૩ (૬૩૦ સ્કે.ફીટ) જે શ્રી ધર્મેશ બચુભાઈ મોદી ના નામે છે. ૨. ફ્લેટ નં. ૪૦૩ (૬૩૦ સ્કે.ફીટ) જે શ્રી ધર્મેશ બચુભાઈ મોદી HUF ના નામે છે બંન્ને "૧" અને "૨" નર્મદા એપાર્ટમેન્ટ, સી.એસ. નં. ૧૯૨૯/બી/૨/એ પ૨ સ્થીત, વોર્ડ નં. ૨, સગ૨ામપુ૨ા, કડીવાલા સ્કુલની પાસે, સુરત, તાલુકા ચોર્ચાસી, જીલ્લો સુરત.

આથી ઉપરોક્ત ઉદ્યાર લેનાર, બાંયધરી આપનાર અને ગીરોને નોટિસ આપવામાં આવે છે કે ૠણ લેનાર, બાંયધરી આપનાર/ગીરો ચૂકવવામાં નિષ્ફળ જવા પર, ક્લમ ૧૩ (૨) હેઠળ જારી કરાચેલ તારીખ ૦૯/૦૮/૨૦૧૬ની નોટિસ દ્વારા માંગણી કરી હતી. અધિકૃત અધિકારીએ વિવિધ પ્રસંગોએ અને છેલ્લે ૦૪.૦૩.૨૦૨૨ ના રોજ SARFAESI અધિનિયમ અને તેના હેઠળ બનાવેલ નિચમો હેઠળ નિર્ધારિત પ્રક્રિયાને અનુસરીને ઉપરોક્ત વર્ણવેલ સ્થાવર સુરક્ષિત અસ્ક્યામતોને ઈ-ઓક્શન દ્વારા વેચવાનો પ્રચાસ કર્યો હતો.

ઉપર જણાવેલ સુરક્ષિત મિલક્તના સંબંધમાં ઉપરોક્ત વિગતો મુજબ હાથ ધરવામાં આવેલ ઈ-હરાજી (ઓ) બિડરોની અછતને કારણે સફળ રહી ન હતી. ત્થારપછી, એક વ્યક્તિએ ઉપર જણાવેલી સુરક્ષિત મિલકતને બેંક અને સૂચિત ખરીદના૨ વચ્ચે સંમત શ૨તો ૫૨ ઉપરોક્ત દરેક સુ૨ક્ષિત સં૫ત્તિ માટે છેલ્લી નિષ્ફળ ઈ-ઓક્શનના રૂ. ૧૯.૪૦ લાંખની આરક્ષિત કિંમત કરતાં વધુ કિંમતે ખરીદવામાં રસ દર્શાવ્યો છે.

ઉપર જણાવેલી સુરક્ષિત મિલકત અગાઉ ચોજાચેલ ઈ-ઓક્શન(ઓ) દ્વારા વેચી શકાતી ન હોવાથી, બેંકે ૧૧.૦૪.૨૦૨૨ ના રોજ અથવા તે પછી જરૂરી દસ્તાવેજો હાથ ધરીને ઉપર જણાવેલી સુરક્ષિત મિલક્ત(ઓ) સૂચિત ખરીદનારને વેચવાનું નક્કી **કર્યું છે.ખાનગી સંધિ** ને આધિન વેચવાનું નકકી કર્યુ છે.

જો ઉપર જણાવેલી સુરક્ષિત મિલકત(ઓ) ના વેચાણની રકમ લોન ખાતા હેઠળ બાકી લેણાંની પ્રાપ્તિ માટે અપૂરતી હોય , તો ઉદ્યાર લેનાર, બાંચધરી આપનાર/મોર્ટગેજર(ઓ) સામે શરૂ કરાયેલી/શરૂ કરાયેલી કાનૂની કાર્યવાહી બાકી લેણાંની સંપૂર્ણ વસૂલાત થાય ત્યાં સુધી ચાલુ રહેશે.

આંથી સૂચિત કરવામાં આવે છે કે જો ઉદ્યાર લેનાર, બાંચઘરી આપનાર/મોર્ટગેજર્સ આ નોટિસની તારીખથી ૧૫ દિવસની અંદર લોન ખાતામાં બાકી લેણાંની સાથે આજદિન સુધીનું વ્યાજ અને આનુષંગિક ખર્ચની ચૂકવણી કરવામાં નિષ્ફળ જાચ , તો ઉપર જણાવેલ સુરક્ષિત મિલકતને તમને કોઈ વધું સૂચના આપ્યા વિના બેંક અને સૂચિત ખરીદનાર નકકી થયેલી શરતો અનુસાર સૂચિત ખરીદનાર ને વેચવામાં આવશે.

લાઃ કશ્વઃ મુંબદ્ય તાઃ કશ્વઃ અંક અદ્યિકૃત અદ્યિકારી આઇડીબીઆઇ બેંક

Government of India Public Enterprises Selection Board invites applications for the post of **Director (Finance)** in

Balmer Lawrie & Co. Limited Last date of receipt of applications in PESB is by 15.00 hours on

> For details login to website http://www.pesb.gov.in

1st June, 2022.

पूनियन बैंक 🕼 Union Bank

યુનિયન બંક ભવન, રજો માળ, સયાજીગંજ, કાલા ઘોડા સર્કલ પાસે, વડોદરા, ગુજરાત.

(જુઓ નિચમ ૮(૧)) કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

नीचे सही કरनारे युनियन **બેंક ओફ ઇन्डिया, समा सावबी शाणाना** अधिङ्गत અધિકારી તરીકે સિંક્યોરીટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્યોરીટી ઈન્ટરેસ્ટ(એન્ફોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨ના નિયમ ૯ સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને **તા. ૦૫.૦૫.૨૦૨૧ ના રોજ** માંગણ નોટીસ જારી કરીને દેવાદાર મે. શિલ્ડ સર્વેલન્સ સિસ્ટમ **પ્રોપ. પદ્માકર આનંદા** સદાશિવ અને સદાશિવ નંદાબેન પદ્માકરને નોટીસમાં જણાવેલ 31. ૪૦.૫૯.૫૨૪.૪૬ (રૂપિયા ચાલીસ લાખ ઓગણસાઈઠ હજાર પાંચસો ચોવીસ અને છેંતાલીસ પૈસા) તરીકેની રકમ વત્તા વ્યાજ કથિત નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર પરલ ચુકવવા જણાવ્યું હતું.

દેવાદાર રકમની પરંત ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી, અહીં દેવાદાર અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે નીચે સહી કરનારે નિયમ ૮ સાથે વંચાતી કથિત કાયદાની કલમ ૧૩(૪) હેઠળ તેમને/તેણીને મળેલી સત્તાની રૂએ અહીં નીરે વર્ણવેલી મિલકતનો કબજો **રસ્મી માર્ચ, ૨૦૨૨ ના રોજ લઈ લીધો છે.**

ખાસ કરીને દેવાદાર અને જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે કે મિલકત સાથે કોઈપણ વ્યવહાર કરવો નહી અને મિલકત સાથે કરાયેલા કોઈપણ વ્યવહારને ચાર્જ **યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની** બાકી ૨કમ **રા. ૪૦,૫૯,૫૨૪.૪૬ (રૂપિયા ચાલીસ લાખ ઓગણસાઈઠ હજાર પાંચસો ચોવીસ અને છેંતાલીસ પૈસા)** અને તેર્ન પરના આગળના વ્યાજને આદિાન રહેશે .

સિક્યોર્ડ મિલકતો છોડાવવા માટે ઉપલબ્ધ સમય અંગે કથિત કાયદાની કલમ ૧૩ની પેટા ક્લમ (૮) ની જોગવાઈઓ પ્રત્યે દેવાદાર/જામીનદારનું ધ્યાન દોરવામાં આવે છે. **આનુષંગિક મિલકત ખાતે સ્થિતઃ-** બ્લોક નં. ૧૨, શિંવમ ટેનામેન્ટ, આમ્રપાલી રેસિડેન્સીની પાસે, જલારામ નગરની સામે, પાર્વતીનગર, નોવિનો તરસાલી રોડ, ારસાલી , વડોદરા-૩૯૦

	ોખ : ૨૨.૦૩.૨૦૨૨ ળ : વડોદરા	અધિકૃત અધિકાર્ર યુનિયન બેંક ઓફ ઈન્ડિય
(Un	INVITATION FOR EXP der Regulation 36A (1) of the Insolvency a	RM G RESSION OF INTEREST and Bankruptcy (Insolvency Resolution Proces as) Regulations, 2016
1.	RELEVANT P Name of the corporate debtor	ARTICULARS Hindusthan National Glass & Industries
2.	Date of incorporation of corporate	Limited 23 rd February 1946
3.	Authority under which corporate debtor is incorporated / registered	Registrar of Companies 'Kolkata'
4.	Corporate identity number / limited liability identification number of corporate debtor	L26109WB1946PLC013294
5.	Address of the registered office and principal office (if any) of corporate debtor	Registered office : 2, Red Cross Place, Kolkata - 700 001, West Bengal, India
6.	Insolvency commencement date of the corporate debtor	21st October 2021
7.	Date of invitation of expression of interest	25 th March 2022
8.	Eligibility for resolution applicants under section 25(2)(h) of the Code is available at:	The detailed EOI and eligibility are available on the website of the corporate debtor at www.hngil.com, under tab "Corporate Insolvency Resolution Proces
9.	Norms of ineligibility applicable under section 29A are available at:	Ineligibility details are available on the website of the corporate debtor www.hngil.com. under tab "Corporate Insolvency Resolution Process"
10.	Last date for receipt of expression of	24th April 2022
11.	Date of issue of provisional list of prospective resolution applicants	04 th May 2022
12.	Last date for submission of objections to provisional list	09 th May 2022
13.	Date of issue of final list of prospective resolution applicants	19 th May 2022
14.	Date of issue of information memorandum, evaluation matrix and request for resolution plans to prospective resolution applicants	09 th May 2022
15.	Manner of obtaining request for resolution plan, evaluation matrix, information memorandum and further information	The Resolution Professional shall share th documents through e-mail or virtual data room after verification of KYC documents and eligibility criteria under section 29A c insolvency and bankruptcy code of 2016 & pre-qualification criteria as approved by committee of creditors.
16.	Last date for submission of resolution plans	08 th June 2022
17.	Manner of submitting resolution plans to resolution professional	Via sealed envelope or E-mail as mentione in the request for resolution plans.
18.	Estimated date for submission of resolution plan to the Adjudicating Authority for approval	25 th June 2022
19.	Name and registration number of the resolution professional	Mr. Girish Siriram Juneja (IBBI/IPA001/IP-P00999/2017-2018/11646
20.	Name, Address and e-email of the resolution professional, as registered with the Board	Mr. Girish Siriram Juneja 22 Dignity Apartments, Bon Bon Lane, 7 Bunglows, Versova, Andheri (West) Mumbai- 400053 E: junejagirish31@gmail.com
21.	Address and email to be used for correspondence with the resolution professional	Address: Mr. Girish Siriram Juneja c/o Restructuring LLP 14th Floor, The Ruby, Senapati Bapat Marg, Dadar (West) Mumbai - 400028 E: eoi.hngil@gmail.co
22.	Further Details are available at or with	Mr. Girish Siriram Juneja Email: eoi.hngil@gmail.com Website: www.hngil.com (under tab "Corporate Insolvency Resolution Process
23.	Date of publication of Form G	25th March 2022

Mr. Girish Siriram Juneia Resolution Professional IP registration details as under: IBBI Registration No.: IBBI/IPA001/IP-P00999/2017-2018/11646. E-mail Id: junejagirish31@gmail.com; eoi.hngil@gmail.com Registered Address: 22 Dignity Apartments, Bon Bon Lane 7 Bunglows, Versova, Andheri (West) Mumbai- 400053

SHIRPUR POWER PRIVATE LIMITED - IN LIQUIDATION

CORRIGENDUM TO e-AUCTION SALE NOTICE PUBLISHED ON FEBRUARY 25, 2022 The e-auction date has been revised and is now scheduled to be held on April 9. 2022 All other timelines have similarly been revised as well.

The revised sale notice is being published herein below. Notice is hereby given by the undersigned to the public in general that the below mentioned assets owned by **Shirpur Power Private Limited- in Liquidation ("SPPL")** are being sold 'via e-Auction under the terms and conditions specified below. The assets are being sold on "AS IS WHERE IS WHATEVER THERE IS AND WITHOUT RECOURSE BASIS" as such sale is without any kind of warranties and indemnities. The under mentioned assets will be sold by online e-Auction through the portal https://www.mstcindia.co.in/content/Forthcoming_e

Auctions_For_All_regions.aspx on: Saturday, April 09, 2022 from 11:00AM to 4:00PM Potential Bidders may bid for one or more Blocks in any combination.

Block	Asset	Reserve Price (INR)	Earnest Money Deposit (INR)	Incremental Amount (INR)
Block A	Slump Sale of all the Assets of Shirpur Power Private Limited - In Liquidation Thermal Power Plant 2x150 MW	314,38,49,770	3,14,38,500	31,43,850
Block B	Standalone: Land (Plot 1 with its Building And Civil Work) Total Area- 8,50,000 Sq. Metres	43,12,75,929	43,12,760	4,31,275
Block C	Standalone: Land (Plot No. 2) Total Area- 3,00,000 Sq Metres	9,26,40,978	9,26,410	92,640
Block D	Standalone: Land Area-10,300 Sq Metre	13,13,250	50,000	20,000
Block E	Standalone: Securities And Financial Assets	29,40,127	50,000	50,000
Block F1 to F10	STANDALONE: Plant & Machinery (including electrical fittings and fixtures) •Furniture & Fixtures	Block F consi		ate sub-block

The breakdown and further information is Office equipment available in the Process Memorandu Laptops and Printers) All interested buyers must adhere to the Process Memorandum. The revised

Participating Process Memorandum is available at www.sppl.decoderesolvency. interested parties must submit the Earnest Money Deposit (EMD) and fulfil the eligibility criteria on or before Friday, April 8, 2022.

Since SPPL is undergoing Liquidation Proceedings under the provisions of the Insolvency and Bankruptcy Code, 2016, all interested bidders are advised to contact the undersigned only by email, by writing to liquidator.sppl@decoderesolvency.com, no other modes of communication would be entertained. The Liquidator reserves the right to approve or reject any H1 bid across any block/s without assigning any reason whatsoever to maximize total overall realization from sale of Liquidator – Shirpur Power Private Limited Place: Mumbai

dushyant.dave@decoderesolvency.com IBBI Registration Number: IBBI/IPA-003/IP-N00061/2017-2018/10502

Ambuja Cement અંબુજા સિમેન્ટ્સ લીમીટેડ રજસ્ટકુંઓફીસ:પી.ઓ. અંબુજાનગર, તાલુકા: કોડીનોર, તાલુકો: ગીર સોમનાથ, ગુજરાત -૩૬૨૭૧૫.

કોર્પોરેટ ઓફીસ : એલીગન્ટ બિઝનેસ પાર્ક, એમઆઇડીસી ક્રોસ રોડ 'બી', અંદોરી ફુર્લા રોડ પડેખે, અંધેરી (પશ્ચિમ), મુંબઇ –૪૦૦ ૦૫૯ **ફોન** : ૦૨૨–૪૦૬૬૭૦૦૦, **ઇમેઇલ**: investors relation@ambujacement.com dorauยะ: www.ambujacement.com, CIN No.: L26942GJ1981PLC004717

૩૯ મી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે કંપનીની ૩૯મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) શુક્રવાર, ૨૯ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ બપોરે ૨.૦૦ ક્લાકે વિડિચો કોન્ફ્ર્સ્ટન્સ (વીસી) / અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો (ઓએવીએમ) સવલત દ્વારા, કંપની કાયદા, ૨૦૧૩ની જોગવાઇઓ અને તે હેઠળ રચાચેલ નિચમો અને સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર રીક્વાચરમેન્ટ્સ) નિચમનો, ર૦૧૫ <u>સાથે વંચાતા કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા જારી કરાયેલ (એમસીએ સરક્યુલર્સ) જનરલ સરક્યુલર નં.૧૪/૨૦૨૦, ૧૭/૨૦૨૦ અને</u> ૨૦/૨૦૨૦,૦૨/૨૦૨૧ અને ૨૧/૨૦૧૨ અનુક્રમે તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦,૧૩ એપ્રિલ, ૨૦૨૦ અને ૫ મે, ૨૦૨૦ અને ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧ મને ૧૪ ડિસેમ્બર, ૨૦૨૧ અને સિક્યોરીટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ્ ઇન્ડિયા (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર રીક્વાચરમેન્ટસ) (લિસ્ટીંગ નિયમનો)ની જોગવાઇઓ અંતર્ગત એક્જસ્થળે સભ્યોની પ્રત્યક્ષ હાજરી વગર ચોજાશે.

કંપનીનો વર્ષ ૨૦૨૦ નો વાર્ષિક અહેવાલ તેમજ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ પુરા થતાં વર્ષના નાણાંકિય નિવેદનો (વાર્ષિક અહેવાલ) જેમના ઇમેઇલ એડ્રેસ કંપની રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ લિંકઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડમાં નોંધાયેલ છે અને જેમના ઇમેઇલ એડ્રેસ કંપની અથવા તેમના સંબંધિત ડિપોઝીટરી પાર્ટીશીપન્ટ (ડિપોઝીટરી) પાસે નોંધાયેલ છે તેવા તમામ સભ્યોને ફક્ત ઇમેઇલથી મોકલવામાં આવશે. જે સભ્યોના ઇમેઇલ એડ્રેસ કંપની/લિકંઇન્ટાઇમ/ડીપી પાસે ૨જીસ્ટર્ડ નથી તે તમામ સભ્યોને વાર્ષિક ઝહેવાલ તેમજ એજાએમની નોટીસ ફીઝીકલ રીતે મોકલવામાં આવશે. સભ્યો ફક્ત વીસી/ઓએવીએમ સવલત માફત એજીએમમાં જોડાઇ શકે છે અને ભાગ લઇ શકે છે. એજીએમમાં જોડાવા માટેની સૂચનાઓ

અને રીમોટ ઇલેક્ટ્રોનિક વોટીંગમાં ભાગ લેવાની પ્રક્રિયા અથવા એજીએમ દરમિયાન ઇ–વોટીંગ સીસ્ટમથી વોટ આપવાની પ્રક્રિયા છે<u>.</u>છુએમની નોટીસમાં જણાવેલ છે. વીસી/ઓએવીએમ મારફત ભાગ લેનાર સભાસદોને કંપની કાયદા,૨૦૧૩ની કલમ ૧૦૩ મુજબ કોરમની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવશે. એજીએમની નોટીસ અને વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ એટલે કે <u>www.ambujacement.com</u> પર અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લીમીટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ અનુક્રમે www.bseindia.com અને www.nseindia.com પર પણ ઉપલબ્ધ રહેશે.

ફીઝીકલ સ્વરૂપે શેરો ધરાવતા સભાસદો જેણે તેમના ઇમેઇલ એડ્રેસ કંપની/ડિપોઝીટરી પાસે નોંધાવ્યા નથી તેઓ એજીએમની નોટીસ, વાર્ષિક અહેવાલ અને/અથવા વીસી/ઓએવીએમ સવલત મારફત એજીએમમાં જોડાવા માટે અને ઇ–વોટીંગ માટેની લોગીન વિગતો નીચેના દસ્તાવે**જોની સ્કેન્ડ નકલો** <u>investors.relation@ambujacement.com</u> પર ઇમેઇલ કરીને મેળવી શકે છે.

- તમારૂ નામ, ફોલિયો નંબર અને સંપુર્ણ સરનામું જણાવતો તમારી સહી કરેલ વિનંતી પત્ર,
- બી) સ્વ પ્રમાણીત પૅન કાર્ડની સ્કેન્ડ નકલ, અને
- સી) કંપનીમાં નોંધાવ્યા મુજબ સભાસદના સરનામાને ટેકો આપતા કોઇપણ દસ્તાવેજની સ્વ પ્રમાણીત નક્લ (જેવા કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાચસન્સ, પાસપોર્ટ)

ફીઝીકલ સ્વરૂપે શેરો ધરાવતા સભ્યોને તેમના પાન, કેવાચસી (ઇમેઇલ એડ્રેસ, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ, સહી વગેરે) અને સેબી સરક્યુલર નં. <u>SEBI/HO/MIRSD_RTAMB/P/CIR/2021/655</u> તારીખ ૩ નવેમ્બર ,ર૦૨૧ સાથે વંચાતા સ્પષ્ટતા સરક્યુલર <u>SEBI/HO/MIRSD_RTAMB/P/CIR/2021/687</u> તારીખ ૧૪ ડિસેમ્બર ,૨૦૨૧ હેઠળ જણાવેલ નોમીનેશન વિગતો ૧ એપ્રિલ, ૨૦૨૩ ના રોજ અથવા એ પહેલા તેમના ફોલિયો નંબરને ફ્રીઝીંગ થતા અટક્વવા માટે સુધરાવવા સલાહ આપવામાં આવે છે.

કંપનીએ કોઇ વિલંબ વગર ડિવિડન્ડની રકમ મેળવવા માટે ઇલેક્ટ્રોનિક ક્લીયરીંગ સર્વિસ (ઇસીએસ)/નેશનલ ઇલેક્ટ્રોનિક ક્લીયરીંગ સર્વિસ (એનઇસીએસ)/રીચલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ)/ડાયરેક્ટ ક્રેડીટ/એનઇએફ્ટી દ્વારા સભાસદ(દો)ના સંબંધિત બેંક એકાઉન્ટમાં સીધા ડિવિડન્ડની ઇલેક્ટ્રોનિક ક્રેડીટની સવલત વધારી છે, ફીઝીકલ સ્વરૂપે શેરો ધરાવતા સભાસદોને તેની બેંક એકાઉન્ટ વિગતોમાં સુધારો કરવા માટે તેમના બેંક એકાઉન્ટની વિગતો તેમજ સભ્યના નામનો અસલ કેન્સલ ચેક અને પાનકાર્ડની સ્વ પ્રમાણીત નકલ લિંકઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ, સી-૧૦૧,૨૪૭ પાર્ક, એલબીએસ માર્ગ, સુર્ચનગર, ગાંધીનગર, વિખ્રોલી વેસ્ટ, મુંબઇ, મહારાષ્ટ્ર-૪૦૦૦૮૩ ને અને ડીમીટે સ્વરૂપે શેરો ધરાવતા તમામ લાચક શેરહોલ્ડરોને તેમના સાચા બેંક એકાઉન્ટ નંબર, તેમજ ૯ અંકનો એમઆઇસીઆર કોડ અને ૧૧ અંકનો આઇએફએસસી કોડ, ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબર ગુરૂવાર, ૩૧ માર્ચ, ૨૦૨૨

કંપની કાયદા, ૨૦૧૩ની કલમ ૧૦૮ના કંપની (વ્યવસ્થાપન અને પ્રશાસન) નિયમો, ૨૦૧૪, સુધારા મુજબ અને સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર રીકવાચરમેન્ટ્સ) નિયમનો, ર૦૧૫ના નિયમન ૪૪ સાથે વાંચન હેઠળ, કંપની તેના સભાસદોને ૩૯મી એજીએમ બોલાવતી નોટીસમાં જણાવેલ કોઇપણ અથવા તમામ કાર્યો પર ઇલેક્ટ્રોનિક માધ્યમોથી વોટ આપવાના તેમના હકનો ઉપયોગ કરવા માટે સીડીએસએલની ઇ-વોટીંગ સેવાઓ મારફત (રીમોટ ઇ-વોટીંગ) ની સવલત પુરી પાડી રહી છે.

મતદાનને લગતી વિગતો નીરો મજબ છે:

ટોલ ફ્રી નંબર: ૧૮૦૦૨૨૫૫૩૩ પર સંપર્ક કરી શકે છે.

પ્રતિબંધો નાબુદ થાય અને ફરી સામાન્ય સંજોગ સ્થપાયે કે તરત જ તે વિના મુલ્યે મોકલશે.

||સી)

સ્થળ: મુંબઇ

- ફીઝીકલસ્વરૂપે અથવા ડિમટીરીયલાઇઝડસ્વરૂપે શેરો ધરાવતા સભાસદો અને જેમના નામ કટ–ઓફ તારીખ એટલે કે શુક્રવાર, ૨૨ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ રજીસ્ટર ઓફ મેમ્બર્સમાં અથવા ડિપોઝીટરીઓ દ્વારા સંચાલિત લાભાર્થી માલિકોના રજીસ્ટરમાં નોંધાચેલ છે તે (લાયક સભાસદો) કંપનીની ૩૯ એજીએમ બોલાવતી નોટીસમાં જણાવેલ કોઇપણ અથવા તમામ કાર્યો પર રીમોટ ઇ-વોટીંગથી તેમજ એજાએમ ખાતે ચોજાનાર મતદાનથી મત આપવાના તેમના હકનો ઉપયોગ કરવા હકદાર ગણાશે.
- રીમોટ ઇ–વોટીંગનો સમયગાળો સોમવાર, રપ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ (સવારે ૧૦.૦૦ કલાકે) શરૂ થશે અને ગુરૂવાર, ૨૮ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ(સાંજે૫.૦૦ કલાકે)પુર્ણ થશે.

ઉપર જણાવેલ તારીખ અને સમય પુર્ણ થયા પછી રીમોટ ઇ-વોટીંગ મોડ્યુલ બંધ કરવામાં આવશે. સભાસદોએ ઠરાવ(વો) પર

દરમિયાન ફરીથી મત આપી શકશે નહી. ફક્ત લાયક સભાસદો જરીમોટ ઇ-વોટીંગ અથવા એજીએમ દરમિયાન ઇ-વોટીંગની

- એક વખત મત આપ્યા પછી, સભાસદોને ત્યારબાદ તેમાં ફેરફાર કરવાની પરવાનગી મળશે નહી. એજીએમમાં વીસી/ઓએવીએમ સવલતો મારફત હાજ્ટ રહેનાર સભાસદો અને જેમણે રીમોટ ઇ–વોટીંગ થી ઠરાવો પર તેમના મત આપ્યા નથી તેવા સભાસદો અને જે લોકો આમ કરવા સક્ષમ નથી તેઓ એજીએમ દરમિયાન ઇ-વોટીંગ પદ્ધતિથી ૪ થી એજીએમ બોલાવતી નવી નોટીસમાં જણાવેલ કોઇપણ અથવા તમામ કાર્યો માટે તેમના મત આપવા લાચક ગણાશે. વધુમાં, લાચક સભાસદ રીમોટ ઇ–વોટીંગથી મત આપવાના તેના હકનો ઉપયોગ કર્યા પછી પણ એજીએમમાં ભાગ લઇ શકે છે, પરંતુ એજીએમ
- નવી નોટીસ મોક્લાયા પછી પરંતુ ઇ-વોટીંગની કટ-ઓફ તારીખ એટલે કે શુક્રવાર, ૨૨ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ અથવા તે પહેલા કોઇ વ્યક્તિ કંપનીની સભ્ય બને છે તો તેવા કિસ્સામાં, તે સીડીએસએલને ઇમેઇલ આઇડી helpdesk.evoting@cdslindia.com પર અથવા શ્રી રાકેશ દલવી, મેનેજર (સીડીએસએલ), સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીઝ (ઇન્ડિયા) લીમીટેડ, એ વિંગ, ૨૫ મો માળ, મેરેથોન ફ્યુચરેક્સ, મફતલાલ મીલ કંપાઉન્ડ, એન.એમ.જોષી માર્ગ, લોઅર પારેલ (ઇસ્ટ), મુબંઇ–૪૦૦૦૧૩, ને helpdesk.evoting@cdslindia.com પર ઇમેઇલ મોકલી શકે છે અથવા સીડીએસએલનો
- એફ) શ્રી સુરેન્દ્ર કાન્સટીયા, મેસર્સ સુરેન્દ્ર કાન્સટીયા એન્ડ એસોસિયેટ્સ, વ્યવસાયિક કંપની સેક્રેટરીઝની યોગ્ય અને પારદર્શક પદ્ધતિમાં મતદાનને સ્ક્રુટીનાઇઝ કરવા માટે સ્ક્રુટીનાઇઝર તરીકે નિમણુંક કરી છે.
- સભાસદો એજીએમમાં વીસી/ઓએવીએમ દ્વારા હાજરી આપી શકે છે અથવા સીડીએસએલ દ્વારા પુરી પડાયેલ એજીએમની લાઇવ વેબકાસ્ટ <u>https://www.evotingindia.com</u> પર તેમના રીમોટ ઇ–વોટીંગ લોગીન વિગતોનો ઉપયોગ કરીને જોઇ શકે છે. જો કોઇ સભાસદ વાર્ષિક અહેવાલની પ્રિન્ટેડ નકલ મેળવવા માંગે છે તો કંપની સભાસદોની ખાસ વિનંતી મળતા અને લોકડાઉનના

ઇ-વોટીંગને લગતી કોઇપણ પુછપરછ અથવા સમસ્યા માટે તમે હેલ્પ સેક્શન હેઠળ <u>www.evotingindia.com</u> પર પ્રાપ્ત ફ્રીક્વન્ટલી આરક્ડ ક્વેશ્વન્સ(એફએક્યુએસ)અને ઇ–વોટીંગ મેન્યુઅલ જોઇ શકો છો અથવા <u>helpdesk.evoting@cdslindia.com</u> પર ઇમેઇલ

મોકલી શકો છો અથવા ૦૨૨–૨૩૦૫૮૭૩૮,૨૩૦૫૮૫૪૨ ઉપર કોલ કરી શકો છો. વાર્ષિક અહેવાલ, નોટીસ, ઇ–વોટીંગ પ્રક્રિયા અને અન્ય આવશ્યક દસ્તાવેજો કંપનીની વેબસાઇટ <u>www.ambujacement.com</u> પર

જોવા માટે ઉપલબ્ધ રહેશે.

ઉપરોક્ત જાણકારી કંપનીના સભ્યોની જાણકારી અને લાભાર્થે અને એમસીએ સરક્યુલર્સ અને સેબી સરક્યુલરના અનુપાલન હેઠળ **પ્રારી કરાઇ** છે. અંબુજા સિમેન્ટ લીમીટેડ વતી

તારીખ : ૨૪ માર્ચ, ૨૦૨૨ સભાસદ નં. એ૧૧૨૬૩ અમદાવાદ, શૃક્રવાર, તા. ૨૫ માર્ચ, ૨૦૨૨

ફાયનાન્સિયલ એક્સપ્રેસ

Tender Notice No. GSECL/Fuel/Imp Coal/5000 GAR/March-2022:

Supply of 15.00 LMT (+20%) of Non-Coking Steam (Thermal) Imported Coal in

Bulk for a period of 1 (one) year extendable for further period of 6 (six) month to

GSECL (Purchaser) on FOR Basis for delivery at the Power Station of GCV (AR) of

5000 Kcal/Kg for its use at Wanakbori, Ukai & Gandhinagar Thermal Power Station

The Tender Specification and Bidding Documents may be downloaded from the

websites https://gsecl.nprocure.com or https://www.nprocure.com (Fo VIEW, DOWNLOAD & ON-LINE SUBMISSION) and www.gsecl.in (For VIEW &

DOWNLOAD). Interested and eligible bidders may submit their "On-line Tender

and "Physical Tender" as prescribed in the Tender Document before the due date

and time of submission. Please be in touch with the Websites for corrigendum

etc. if any, till the last date of submission of bids.

 ${\sf GSECL\ invites\ the\ above\ tenders\ from\ eligible\ bidders\ through\ e-tendering\ process.}$

adanı

અદાણી હાઉસિંગ ફાચનાન્સ

GUJARAT STATE ELECTRICITY CORPORATION LTD.
VIDYUT BHAVAN, RACE COURSE, VADODARA, INDIA - 390007
Phone Nos: 91-265-6612341, Fax: 91-0265-2355195
e-mail: cefuel.gsecl@gebmail.com | Website : www.gsecl.in
CIN: U40100GJ1993SGC019988 પ્રાઇવેટ લીમીટેડ **રજીસ્ટર્ડ ઓફીસ** : શિખર, મીઠાખળી સર્કલ પાસે નવરંગપુરા, અમદાવાદ–૩૮૦૦૦૯, ગુજરાત, ભારત. **કોર્પોરેટ ઓફીસ** : વન બીકેસી, સી-વિંગ, ૧૦૦૪/૫, દસમો માળ, બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ, બાંદ્રા (ઇસ્ટ), મુંબઇ-૪૦૦ ૦૫૧. મહારાષ્ટ્રા, ભારત. CIN: U65999GJ2017PTC098960

સુધારો

આ સમાચારપત્રમાં ૨૪.૦૩.૨૦૨૨ ના રોજપ્રસિદ્ધ થયેલ ઇ–હરાજી સહ વેચાણની જાહેર નોટીસ જોવા વિનંતી છે આ નોટીસમાં રીઝર્વ ફિંમત અને ઇએમડીની રકમ ખોર્ટ પ્રિન્ટ થઇ છે જે નીચે મુજબ વાંચવા વિનંતી છે રીઝર્વ કિંમત : રૂા.૧૮૦૦૦૦૦/– અને ઇએમડી રૂા મન્ય તમામ વિગતો યથાવત રહેશે.

સલા/– અદિાકૃત અદિાકારી અદાણી હાઉસિંગ ફાચનાન્સ પ્રાઇવેટ લીમીટેક ઋ ભાષાંતમાં ત્રુટી અથવા વિશંગતા હશે તો અંગ્રેજી સંસ્ક્ષ્ણ માન્ય રહેશે.

Ambuja Cement અંબુજા સીમેન્ટ લીમીટેડ

Chief Engineer (Fuel) GSECL, Corporate Office, Vadodara, Gujarat (India)

રજીસ્ટર્ડ ઓફીસ: પી.ઓ. અંબુજોનગર, તાલુકો: કોડીનાર, જીલો: ગીર સોમનાથ, ગુજરાત –૩૬૨ ૭૧૫ **કોર્પોરેટ ઓફીસ**: એલીગન્ટ બિઝનેસ પાર્ક, એમઆઇડીસી ક્રોસ રોડ "બી", અંધેરી કુર્લા રોડ, અંધેરી (ઇસ્ટ), મુંબઇ –૪૦૦ ૦૫૯. CIN: L26942GJ1981PLC004717 - वेजसाधर : www.ambujacement.com धभेष्ठव : shares@ambujacement.com

નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે કંપની કાયદા,૨૦૧૩ કલમ ૯૧ અને તે હેઠળ લાગુ નિયમો અન્વયે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજપુરા થતાં કોર્પોરેટ નાણાંકિય વર્ષ માટેના અંતિમ ડિવિડન્ડની ચુકવણીના કાર્ય માટે રેકોર્ડ ડેટ તરીકે શુક્રવાર, ૧ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ નિયત કરી છે.

અંતિમ ડિવિડન્ડ આ હેતુ માટે ડિપોઝીટરીઓ દ્વારા કંપનીને પુરા પડાચેલ ડાઉનલોડ મુજબ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ઇક્વીટી શેરો ધરાવતા હોય તેના સંબંધમાં શુક્રવાર, ૧ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ શેરોના લાભાર્થી માલિકોને ચુકવવામાં આવશે. ફિઝિકલ સ્વરૂ પે શેરો ધરાવનારના કિસ્સામાં, શુક્રવાર, ૧ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ રજીસ્ટર ઓફ મેમ્બર્સમાં જે શેરહોલ્ડરોના નામ હાજર છે તેમે ચુકવવામાં આવશે.

ું સભ્યોને ફીઝીકલ સ્વરૂપમાં શેરો ધરાવતા હોય ના સબંધમાં કંપની રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટને અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપ શેરો ધરાવતા હોય તો તેમના સંબંધિત ડિપોઝીટરી પાર્ટીશીપ્ટને તેમની બેંક એકાઉન્ટ વિગતો, સરનામામાં ફેરફાર વગેરે પુરા પાડવા વિનંતી છે.

આ માહિતી કંપનીની વેબસાઇટ http://www.ambujacement.com/investors/shareholders-information/disclosuresto-the-stock-exchanges/notice-for-book-closures- and-record-date અને જ્યાં કંપનીના શેર લિસ્ટેડ થયેલા છે તે શેરબજારોની વેબસાઇટ www.bseindia.com અને www.nseindia.com ઉપર પ્રાપ્ય છે.

અંબુજા સીમેન્ટ્સ લીમીટેડ વતી

સ્થળ : મુંબઈ તારીખ : ૨૪ માર્ચ. ૨૦૨૨

સહી/-રાજીવ ગાંધી કંપની સેક્રેટરી

Registered & Corporate Office: Cement House, 121, Maharshi Karve Road, Mumbai - 400020 CIN: L26940MH1936PLC002515, Phone: +91 22 4159 3321; Fax: +91 22 6631 7458, Website: www.acclimited.com; Investor Support: ACC-InvestorSupport@acclimited.com

NOTICE FOR THE 86[™] ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 86th Annual General Meeting ("AGM") of ACC Limited ("Company") is scheduled to be convened on Thursday, April 21, 2022 at 3:00 pm IST through Video Conference ("VC")/ Other Audio Visual Means ("OAVM") facility as per the provisions of the Companies Act, 2013 and Rules framed thereunder read with General Circular Nos.14/2020, 17/2020, 20/2020, 02/2021 and 21/2021 dated April 8, 2020, April 13, 2020, May 5, 2020, January 13, 2021 and December 14, 2021 respectively, issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and the provisions of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended ("Listing Regulations"), without the physical presence of the Members at a

The Annual Report of the Company for the year 2021 including the Financial Statements for the year ended December 31, 2021 ("Annual Report") along with Notice of the AGM were sent by e-mail on March 23, 2022 to all those Members whose e-mail addresses are registered with the Company or with their respective Depository Participants ("DPs") or the Company's Registrar and Transfer Agent, KFin Technologies Limited (formerly known as KFin Technologies Private Limited) ("KFintech"). The Annual Report along with Notice of the AGM were sent in physical mode on March 23, 2022 and March 24, 2022 to all those Members whose e-mail addresses are not registered with the Company/KFintech/DPs.

Members can join and participate in the AGM through VC/ OAVM facility only. The instructions for joining the AGM and the manner of participation in the remote electronic voting or casting vote through the e-Voting system during the AGM are provided in the Notice of the AGM. Members participating through the VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013. The Annual Report of the Company for the year 2021 along with the Notice of AGM will be available on the website of the Company, i.e. www.acclimited.com and the website of BSE Limited and The National Stock Exchange of India Limited, i.e. <u>www.bseindia.com</u> and <u>www.nseindia.com</u>.

 $As per the process \ advised \ by \ the \ Depository, \ Members \ holding \ shares \ in \ demat \ form \ whose \ e-mail \ addresses \ are$ not registered with their Depository, are requested to register their e-mail address for receipt of Notice of the 86^{th} AGM, Annual Report and login details for joining the 86^{th} AGM through VC/OAVM facility including e-Voting with their Depository only. The registered e-mail address will also be used for sending future communications.

Members holding shares in physical form who have not registered their e-mail addresses with the Company can obtain Notice of the AGM, Annual Report and/or login details for joining the AGM through VC/OAVM facility including e-Voting, by providing a duly signed request letter with Folio No., name of the shareholder, scanned copy of the share certificate (front and back), self-attested scanned copy of PAN and Aadhaar by e-mail to einward.ris@kfintech.com.

Members holding shares in physical form are advised to update their PAN, KYC (e-mail address, mobile number, bank account, signature etc.) and Nomination details as mandated under SEBI Circular No. SEBI/HO/MIRSD/ MIRSD RTAMB/P/CIR/2021/655 dated November 3, 2021 read with clarification circular SEBI/HO/MIRSD/ MIRSD_RTAMB/P/CIR/2021/687 dated December 14, 2021 to avoid freezing of their folios on or after April 1,

The Company has extended the facility of electronic credit of dividend directly to the respective bank accounts of the Member(s) through Electronic Clearing Service (ECS)/National Electronic Clearing Service (NECS)/ Automated Clearing House (ACH)/ Real Time Gross Settlement (RTGS)/ Direct Credit/ IMPS/ NEFT etc. In order to receive the dividend without any delay, the Members holding shares in physical form are requested to submit particulars of their bank accounts in 'Form ISR - 1' along with the original cancelled cheque bearing the name of the Member to KFintech/ Company to update their bank account details and all the eligible Members holding shares in demat mode are requested to update with their respective DPs before Thursday, March 31, 2022, their correct Bank Account Number, including 9 Digit MICR Code and 11 digit IFSC Code, e-mail address and mobile number. Members holding shares in physical form may communicate these details to KFintech having address at KFin Technologies Limited, Selenium Tower B, Plot 31-32, Gachibowli Financial District, Nanakramguda, Hyderabad – 500 032, before Thursday, March 31, 2022 by quoting the reference folio number and attaching photocopy of the cheque leaf of their active bank account and a self-attested copy of their PAN card.

Members holding shares either in physical form or in dematerialized form and whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners, as on the record date, i.e. **Tuesday, April 5, 2022**, shall be entitled to receive dividend from the Company.

In terms of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended, and Regulation 44 of the Listing Regulations, the Company is providing the facility to its Members to exercise their right to vote by electronic means on any or all of the businesses specifie in the Notice convening the 86th AGM of the Company through e-Voting services of NSDL.

The relevant details of voting are given as under:

- a) Members holding shares either in physical form or in dematerialized form and whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners, as on the cut-off date, i.e. **Thursday, April 14, 2022** ("eligible Members"), shall be entitled to exercise their right to vote by remote e-Voting as well as voting to be held at AGM on any or all of the businesses specified in the Notice convening the 86th AGM of the Company;
- b) The remote e-Voting period commences on Saturday, April 16, 2022 (9:00 a.m. IST) and ends on Wednesday, April 20, 2022 (5:00 p.m. IST);
- The remote e-Voting module shall be disabled for voting after the expiry of the date and time mentioned above. Once the vote on resolution(s) is cast by the Member, the Member shall not be allowed to change it
- d) Those Members, who will be present in the AGM through VC/ OAVM facility and have not cast their vote on the Resolutions through remote e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-Voting system during the AGM on all of the businesses specified in the Notice convening the 86th AGM, Further, an eligible Member may participate in the AGM even after exercising his right to vote through remote e-Voting but shall not vote again during the AGM. Only the eligible Members shall be entitled to avail the facility of remote e-Voting or the e-Voting during the AGM;
- A person who has become a Member of the Company after the Notice is being sent but on or before the cut-off date for e-Voting, i.e. Thursday, April 14, 2022, may obtain the Login ID and Password by following the instructions as mentioned in Notice of the 86th AGM or sending a request at evoting@nsdl.co.in. In case of any query regarding e-Voting, Members may contact Mr. Anubhav Saxena, Assistant Manager, NSDL at 1800 1020 990 and 1800 22 44 30 or send request at anubhavs@nsdl.co.in/evoting@nsdl.co.in;
- The Board of Directors has appointed Mr. Atul Mehta, Partner, failing him, Ms. Ashwini Inamdar of M/s. Mehta & Mehta, Practicing Company Secretaries as a Scrutinizer to scrutinize the voting process in a fair and transparent manner; and
- g) Members will be able to attend the AGM through VC/ OAVM or view the live webcast of AGM provided by NSDL at https://www.evoting.nsdl.com by using their e-Voting login credentials. If any Member wishes to get a printed copy of the Annual Report, the Company will send the same, without any

charges, upon receipt of a specific request from the Member, at the earliest considering any administrative and government restrictions on account of Covid-19 pandemic situation. In case of any queries relating to e-Voting, you may refer to the FAQs for Shareholders and e-Voting user

manual for Shareholders available at the download section of https://www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 or send a request at evoting@nsdl.co.in. The Annual Report, Notice including the e-Voting procedure and the other relevant documents, are also available on

the Company's website at $\underline{www.acclimited.com}$ for inspection.

The above information is being issued for the information and benefit of all the Members of the Company and is in By Order of the Board of Directors

For ACC Limited

Rajiv Choubey Chief Legal Officer & Company Secretary ACS No.: 13063

Place: Mumbai Date: March 25, 2022

compliance with the MCA Circulars.

(રાજીવ ગાંધી)

કંપની સચિવ